



કાઇમ બ્રાંચ

સુરત શહેર

સરનામુ- ચોક બજાર કુરજા, ધનરાજ પેટ્રોલ પંપની
બાજુમાં, સુરત શહેર

સંપર્ક નંબર-૦૨૬૧ - ૨૪૩૬૦૨૪



સને ૨૦૦૮ થી વરાછા પો.સ્ટે. ના બળાત્કારના ગુનાના વોન્ટેડ આરોપીને ઝડપી

પાડતી સુરત શહેર કાઇમ બ્રાંચ

સુરત શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જાળવાય રહે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુસર સુરત શહેરના પોલીસ કમિશ્નર સા.શ્રી તથા અધિક પો.કમિ.શ્રી કાઇમ એન્ડ ટ્રાફિક સાહેબ તથા કાઇમ બ્રાંચના DCP સા. તથા ACP કાઇમ સા. ની સુચના મુજબ તેમજ પો.ઇન્સ. ડી.સી.બી. નાઓએ સુરત શહેરમાં નોંધાયેલ ખુન, બળાત્કારના વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા અને નાસતા-ફરતા વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા જરૂરી સુચના તેમજ માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને કાઇમ બ્રાંચના પો.સ.ઇ.નાઓ તેમની ટીમના માણસો સાથે આરોપીઓની હકીકત મેળવવા વર્ક-આઉટમાં હતા.

આજરોજ પેટ્રોલીંગ દરમ્યાન અ.હે.કો. ચન્દ્રપ્રકાશ ગણેશપ્રસાદ અને હે.કો. દિનેશ રમેશભાઈ નાઓને મળેલ બાતમી હકીકત આધારે પો.સ.ઇ. શ્રી મનોજ પાટીલ નાઓએ વરાછા પો.સ્ટે. ફર્સ્ટ ગુ.ર.નં. ૨૨૩/૨૦૦૮ ઇ.પી.કો. કલમ ૩૭૬(જ), ૧૧૪ મુજબના ગુનાનો નાસતો-ફરતો વોન્ટેડ આરોપી નામે- વિક્રમસીંગ મહેશ્વર યાદવ ઉ.વ.૩૫ ધંધો- નોકરી રહે. ચોથા માળે ટેરેસ ઉપર, કૈલાશ કોમ્પ્લેક્ષ, હીરાબજાર પો.ચોકી સામે, મહીધરપુરા, સુરત. મુળગામ-સરૂરપુર થાના-કુમારગંજ તહે.મિલ્કીપુર જી.કૈઝાબાદ (યુ.પી.) નાઓને કતારગામ નંદુડોશીની વાડી પાસેથી પકડી પાડી આજરોજ તા.૦૪/૦૨/૨૦૧૯ ના કલાક: ૧૮/૫૦ વાગ્યે સી.આર.પી.સી. કલમ ૪૧(૧)આઇ મુજબ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી વરાછા પો.સ્ટે. ને સોંપવા કાર્યવાહી કરેલ છે.

સદર ગુનાની હકીકત એવી છે કે, આ કામના ફરીયાદીશ્રી નાઓ તેમના પતિ સાથે તા.૨૯/૦૩/૨૦૦૮ ના રોજ વતનમાં ગયેલ અને તેમની બે દિકરી ઉ.વ.૧૩ અને ઉ.વ.૯ ને તેમના ભત્રીજા કપિલદેવ લાલચંદ્ર પાંડે નાઓને સોંપીને ગયેલ હતા. ત્યારબાદ આરોપી કપિલદેવ લાલચંદ્ર પાંડે અને વિક્રમસીંગ મહેશ્વર યાદવ નાઓએ ફરી.શ્રીની દિકરી ની દિકરી ઉ.વ.૧૩ વર્ષ નાની એકબીજાની મદદગારી કરી મોઢુ દબાવી બળજબરીથી બળાત્કાર કરી ગુનો આચરેલ હતો. અને ત્યારપછી બન્ને આરોપીઓ આજદીન સુધી નાસતા-ફરતા હતા જેમાં વિક્રમસીંગ મહેશ્વર યાદવને પકડી પાડવામાં આવેલ છે.